

મે. પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં, મુ. પાલિતાણા.

સમરી સ્યુટ નં.-૧૯/૨૦૨૪.

આંક-૧ લગત હુકમ :-

(૧) વાદીના દાવાની ટુંકમાં હકીકત જોવામાં આવે તો, તેઓ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે બેન્કીંગને લગતુ કાર્ય કરે છે. વાદી નેશનલાઇઝ બેન્ક હોઈ, પ્રતિવાદીને કૃષિ-વિષયક ઉત્પાદન હેતુ પાક-ધિરાણ માટે રૂ. ૬૭,૦૦૦/-ની લોન આપેલ, જે રકમ ૧૧.૭૫%ના વ્યાજ સાથે પ્રતિવાદી પાસેથી વસૂલ મેળવવા તથા પ્રતિવાદી જો તેમ કરવામાં કસૂર કરે તો, તા.૨૫/૧/૨૦૨૪ સુધીના વ્યાજસહિતની બાકી રકમ રૂ. ૫૫,૧૫૨/-પ્રતિવાદીની જાત તથા દરેક પ્રકારની મિલકતમાંથી સદર રકમ વસૂલ મેળવવા હુકમનામુ મેળવવા તેમજ સદર દાવાનો તમામ ખર્ચ પ્રતિવાદી પાસેથી અપાવવા તેઓ(વાદી)એ વિનંતી કરેલ છે.

(૨) આ કામના પ્રતિવાદીને દાવાના સમન્સ(આંક-૫)ની યોગ્ય બજવાણી થવા છતાં, તેઓ દાવાના કામે હાજર થયેલ નહીં. પ્રતિવાદી સદરહું ચુકાદા માટેના કારણની અને માંગેલી રકમ અંગે આવા સમન્સ બજ્યાની તારીખથી ૧૦(દસ) દિવસની અંદર કોઈપણ સમયે, સોગંદનામાથી કે, નિયત સમયમર્યાદામાં હાજર થયેલ નથી કે, બચાવ કરવાની પરવાનગી માટે પ્રતિવાદીએ અરજી કરેલ નથી. જેથી સિવિલ પ્રોસીજર કોડના હુકમ(ઓર્ડર)-૩૭, રૂલ -૨(૩)ના પ્રબંધો લક્ષમાં લેતા, તેમાં વાદીની માંગણી પ્રમાણેની આવી રકમનું હુકમનામુ મેળવવા અધિકૃત થશે ; જે સમન્સમાં ઉલ્લેખિત રકમથી વધુ ન હોય તેવી રકમ અને તેવી રકમ ઉપર નિર્દિષ્ટ દરથી થતા વ્યાજ અને અવાર-નવાર હાઈકોર્ટ નક્કી કરે, તે ખર્ચની રકમ સહિતનું હુકમનામુ મેળવવા અધિકૃત થશે વિ. તે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે અને વાદી તરફે આંક-૬ તે મુજબ જજમેન્ટ જાહેર કરવા સોગંદનામાથી જાહેર કરેલ છે. સબબ ઉપરોક્ત તમામ રેકર્ડ તથા ઉપરોક્ત સી.પી.સી. ઓર્ડર-૩૭, રૂલ-૨(૩)ના પ્રબંધો ધ્યાને લેતા, વાદી તે મુજબ હુકમનામુ મેળવવા હક્કદાર બને છે.

(૩) વાદી બેન્કે પ્રતિવાદીને રૂ.૬૭,૦૦૦/-ની લોન આપેલ હોવા અંગે વાદી બેન્કના અધિકૃત અધિકારી/મેનેજરે આંક-૪ના ડી.ઇ.લિસ્ટથી આંક-૮થી પ્રતિવાદીએ કૃષિ-વિષયક ધિરાણ(લોન) મેળવવા કરેલ અરજીપત્રક, આંક-૮થી લેટર ઓફ એરેન્જમેન્ટ, આંક-૧૦થી હાયપોથીકેશન એગ્રીમેન્ટ, આંક-૧૧થી ઇન્ટરવ્યુ-કમ-એસેમેન્ટ ફોર્મ, આંક-૧૨થી કન્સેન્ટ-ક્લોઝ, આંક-૧૩થી રીવાઈવલ લેટર, આંક-૧૪થી ગામ નમૂના નં.-૮/અ તથા ૭/૧૨, આંક-૧૫થી વાદી બેન્કે વકીલશ્રી દ્વારા પ્રતિવાદીને મોકલેલ નોટીસ, આંક-૧૬થી પ્રતિવાદી એ લીધેલ લોનનું બેન્ક-સ્ટેટમેન્ટ તેમજ આંક-૧૭થી એનેક્ષર-III રજુ કરેલ છે. આમ, વાદી બેન્ક દ્વારા રજુ થયેલ ઉપરોક્ત તમામ દસ્તાવેજો પરથી તા.૨૫/૧/૨૦૨૪ સુધીમાં કુલ રૂ.૫૫,૧૫૨/-પ્રતિવાદી પાસેથી લેણા હોવાનું સાબિત થાય છે. વધુમાં, તેઓએ લોન લેતી વખતે જરૂરી દસ્તાવેજો જેમકે કરાર, એકરારનામું, કબુલાતનામું, તારણ વિ. ડોક્યુમેન્ટ્સ સ્વ-હસ્તાક્ષરમાં સહીઓ કરી આપેલ છે. પ્રતિવાદીએ લોન લીધા બાદ, નિયત સમયમર્યાદામાં હપ્તા ભરેલ ન હોઈ, વાદી બેન્ક દ્વારા તેઓને વકીલ મારફત નોટીસ મોકલવા છતાં, પ્રતિવાદી દ્વારા નોટીસનો કોઈ જવાબ આપેલ નથી. આ સંજોગોમાં, પ્રતિવાદીએ લોન-કરાર મુજબની વ્યાજસહિતની રકમ વસુલ આપેલ ન હોઈ, વાદી બેન્કે હાલનો દાવો કર્યો છે. વધુમાં, વાદી બેન્ક દ્વારા દાવામાં પ્રતિવાદી પાસેથી લેણી રકમ ઉપર ૧૧.૭૫% વ્યાજની માંગણી કરેલ છે, તે મુજબ પ્રતિવાદી વાદી બેન્કને લેણી રકમની ચુકવણી કરે તો, તે ન્યાયોચિત રહેશે તેવું માફ માનવું છે જેથી, નીચે મુજબનો આખરી હુકમ ફરમાવવામાં આવે છે.

—:(હુ ક મ):—

- વાદીનો દાવો આથી, **મંજૂર** કરવામાં આવે છે.
- પ્રતિવાદીએ લોન-ધિરાણના બાકી લેણા પેટે વાદીને રૂ.૫૫,૧૫૨/-(અંકે રૂપિયા પંચાવનહજાર એકસો બાવન પુરા)વસુલ થતા સુધી ૧૧.૭૫%ના દરે વ્યાજસહિત ચૂકવી આપવા.

- જો પ્રતિવાદી વાદી બેન્કની લેણી રકમ વસૂલ આપવામાં કસૂર કરે તો, પ્રતિવાદીની જાત તથા તમામ મિલકતથી સદરહું લેણી રકમ વસૂલ મેળવવા વાદી બેન્ક હક્કદાર રહેશે તેવું આથી, ઠરાવવામાં આવે છે.
- પ્રતિવાદીએ આ દાવાનો ખર્ચ વાદી બેન્કને ચૂકવી આપવો.
- હુકમ મુજબ હુકમનામું દોરવું.
હુકમ આજ તારીખ-૫, માહે-સપ્ટેમ્બર, સને-૨૦૨૪ના રોજ ખુદ્દી અદાલતમાં વાંચી-સંભળાવી, જાહેર કર્યો.

સ્થળ:પાલિતાણા.

(રાજેશ માંદિયાભાઈ ઘોડી)
પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ-પાલિતાણા.
(કોડ નં.-જી.જે.૦૧૧૭૫).

એચ.બી.જોષી(પી.એ.).